



**SURAT MUNICIPAL CORPORATION
WEST ZONE
QUOTATION/CONSENT FORM**

QUOTATION NO. DY.COMMISSIONER /West Zone/14/2024-25		DATE : 29/07/2024
Name of Work: પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં ભાઠા, ભાટપોર, ઈચ્છાપોર, ભેંસાણ, ઓખા, વણકલા, ચીચી, વિહેલમાં જુદા જુદા જગ્યાઓએ ૧/૨" થી ૨" વ્યાસના પાણીના નળ કનેક્શનોના લીકેજ દુરસ્ત કરવાનું કામ.		
ESTIMATED AMOUNT :Rs.-----		EMD AMOUNT: Rs.5000/-
validity period : 120 Days	Agency Category : -----	
Required Documents		
1	Solvency Certificate	Yes
2	Registration Certificate	Yes
3	GST Registration Certificate	Yes
4	Experience Certificate	Yes
5	Authorized Letter	Yes
QUOTATION/CONSENT AVAILABILITY		
ISSUING AUTHORITY	Executive Engineer, West Zone, Surat	
ISSUING OFFICE	Administrative office, West Zone(Rander), Balasaheb Debras Road, Tadwadi, Rander, Surat	
INVITING AUTHORITY	Executive Engineer, West Zone, Surat	
Submission Date	Last date:06/08/2024	
	SUBMITTED To,	
Time : 18.00 P.M.	EXECUTIVE ENGINEER ADMINISTRATIVE BUILDING, WEST ZONE (RANDER), BALASAHEB DEVRAS ROAD, TADWADI, RANDER, SURAT	
<u>GST CLAUSE FOR CONSTRUCTION/ ERECTION/ COMMISSIONING/ INSTALLATION/ REPAIRS/ MAINTENANCE/ RENOVATION/ FABRICATION OF STRUCTURE INCLUDING BUILDING (MEANS ALL WORKS CONTRACT/ TURN KEY PROJECT/ SUPPLY OF MATERIAL/ GOODS)</u>		
GST (Goods and service tax has come in existence from 1st July, 2017. Contractor / Successful Bidder is bound to pay any amount of GST prescribed by the govt. of India as per the terms of contract agreed upon during the course of execution of this contract.		
During the course of execution of contract, if there is any change in rate if GST (Goods and Service Tax) by the Government, the same shall be reimbursed/recovered separately by SMC. subject to the submission of original receipt/proof for the amounts actually remitted by the contractor/ successful Tenderer to the competent Authority along with a certificate from Chartered Accountant of contractor/ successful Tenderer certifying that the amount of GST paid to the government and the same shall be intimated/submitted/claimed within 30 (Thirty) days from the date of payment. Remittance of GST within stipulated period shall be the sole responsibility of the successful contractor/Tenderer, failing which SMC may recover the amount due, from any other payable dues with SMC and decision of Municipal Commissioner shall be final and binding on the contractor/ successful Tenderer in this regard. Further, the non-payment of GST to the government may lead to the termination of contract and forfeiture of security Deposit/Performance Guarantee Amount.		
If imposition of any other new taxes/Duties/levies/Cess or any other incidentals etc. or any increase in the existing taxes/Duties/Levies/Cess or any other incidentals etc. (Excluding GST) are imposed during the course of the contract, the same shall be borne by the successful contractor/Tenderer only, in no case SMC shall be liable for the same.		
SIGNATURE OF ISSUING AUTHORITY		
---SD---		
EXECUTIVE ENGINEER WEST ZONE SURAT MUNICIPAL CORPORATION		